



## એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ(ટેકનીકલ )

એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરીંગ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ -૩૮૦ ૦૧૫

ડીપ્લોમાં થી ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમો ચલાવતી સ્વનિર્ભર ઈજનેરી સંસ્થાઓ ખાતે ખાલી રહેલી બેઠકો પર ઓફ લાઈન પ્રવેશ બાબતે (પ્રવેશ વર્ષ ૨૦૨૧-૨૨)

ડીપ્લોમાં થી ડિગ્રી ઈજનેરી ની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ના રાઉન્ડ -૨ ની પ્રવેશ કાર્યવાહી તા. ૨૭.૦૮.૨૦૨૧ ના રોજ પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે. ટેકનીકલ શિક્ષણ સંચાલન તાબા હેઠળની ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમો ચલાવતી રાજ્યની સ્વનિર્ભર ઈજનેરી સંસ્થાઓ ખાતે રાઉન્ડ -૨ની પ્રવેશ કાર્યવાહી બાદ ની નોન એલોટમેન્ટ , નોન રીપોર્ટીંગ અને પ્રવેશ રદ કરાવવાના ના કારણે ખાલી રહેલી બેઠકોનો પ્રવેશ કાર્યવાહી નીચે મુજબ છે. સદર પ્રક્રિયા બાદ ખાલી રહેલી બેઠકો શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનાં પ્રવર્તમાન જાહેરનામાં મુજબ ભરવાની થાય છે. જેનાં અનુસંધાને સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે ખાલી રહેલી બેઠકોની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ [www.jacpldce.ac.in/d2d.asp](http://www.jacpldce.ac.in/d2d.asp) ઉપર મુકવામાં આવેલ છે પ્રવેશ લાયકાત :

- (૧) સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ વર્ષ ૨૦૨૧ નો મેરીટ નંબર ક્રમાંક ધરાવતા હોય,
  - (૨) AICTE ને રાજ્ય સરકારશ્રીના નિયમો અનુસાર લઘુતમ પ્રવેશ લાયકાત ધરાવતા અને વર્ષ ૨૦૨૧ ના યુનિવર્સિટીના મોડા પરિણામ જાહેર થવાને લીધે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય,
  - (૩) AICTE ને રાજ્ય સરકારશ્રીના નિયમો અનુસાર લઘુતમ પ્રવેશ લાયકાત ધરાવતા અને ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યમાંથી વર્ષ ૨૦૨૧ કે તેના અગાઉ ના વર્ષોમાં ડીપ્લોમાં પાસ કરેલ હોય
  - (૪) ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય યુનિવર્સિટીમાંથી D.Voc. Stream માંથી ડીપ્લોમાં ધરાવતા હોય તેવા ઉમેદવારો
  - (૫) ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય યુનિવર્સિટીમાંથી B.SCની ડિગ્રી ધરાવતા અને જેઓએ ધો.૧૨(વી.પ્ર)ની પરીક્ષા ગણિત વિષય સાથે ઉત્તીર્ણ કરેલ હોય તેવા ઉમેદવારો
  - (૬) AICTE ને રાજ્ય સરકારશ્રીના નિયમો અનુસાર લઘુતમ પ્રવેશ લાયકાત ધરાવતા અને અન્ય રાજ્યમાંથી વર્ષ ૨૦૨૧ કે તેના અગાઉ ના વર્ષોમાં ડીપ્લોમાં પાસ કરેલ હોય તેવા ઉમેદવારો
- પ્રવેશ કાર્યક્રમ :

Sr. No.	Activities	Date
1	SFI Vacant Seat information on ACPC Website	31.08.2021
2	Vacant Seat Information on Institute Website	02.09.2021
3	Vacant Seat Admission : SFI <ul style="list-style-type: none"><li>• Application Form Distribution</li><li>• Merit List Declaration on Institute Website</li><li>• Admission Counselling at Institute level</li></ul>	02.09.2021 to 10.10.2021

ખાલી પડેલ બેઠકો પર પ્રવેશ કાર્યવાહી તા. 02/09/2021 થી તા. 10.10.2021 દરમિયાન જે તે સંસ્થાસ્તરે યોજાશે. ઉમેદવારે (૧) જે-તે સંસ્થાના નોટીસ બોર્ડ અને વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ ખાલી બેઠકોનો અભ્યાસ કરી (૨) સ્વનિર્ભર સંસ્થાઓની ફી ને ધ્યાને રાખી સંબંધિત સંસ્થાઓ ખાતે સંસ્થા દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ જે તે સંસ્થા ખાતે નિયત ફી રૂ. ૩૦૦/- રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે. સદર પ્રક્રિયા અર્થે બહોળી પબ્લીસીટી સંસ્થા સ્તરે કરવાની રહેશે. જે તે સંસ્થાના પ્રવેશ કાર્યક્રમ અનુસાર ઉમેદવારે સ્વખર્ચે જે તે સંસ્થાખાતે જવાનું રહેશે. અગાઉનો પ્રવેશ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ પ્રવેશ રદ થતા ઉમેદવારને ફી રીફંડ', સરકારશ્રીના પ્રવેશ અંગેના જાહેરનામા ના નિયમ "Cancellation Of Admission And Refund Of Fees" પ્રમાણે થશે.

સંસ્થાઓ ની ખાલી રહેલી બેઠકો, ફી તેમજ અન્ય જરૂરી માહિતી સમિતિ ની વેબસાઈટ

[www.jacpcldce.ac.in/d2d.asp](http://www.jacpcldce.ac.in/d2d.asp) ઉપર ઉપલબ્ધ છે. પ્રવેશ કાયમ કરાવવા માટે અસલ પ્રમાણપત્રો

ચકાસણી અર્થે આવશ્યક હોઈ સાથે રાખવાના રહેશે.ઉમેદવારે કોઈપણ અસલ પ્રમાણપત્રો સંસ્થા ખાતે

જમા કરાવવા ના રહેશે નહિ. પ્રવેશ મળશે જ તેની કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. વધુ વિગત

તેમજ Latest Updates માટે સમિતિની વેબસાઈટ [www.jacpcldce.ac.in/d2d.asp](http://www.jacpcldce.ac.in/d2d.asp) વખતો વખત જોવા

જણાવવામાં આવે છે.

તા. ૩૧.૦૮.૨૦૨૧

- મેમ્બર સેક્રેટરી

**Help Line Number : 079-26566000 (24 × 7)**